



## બળજબરીપૂર્વકનાં અને વહેલાં લગ્ન

કોઈને લગ્ન માટે બળજબરી કરવીએ ઓસ્ટ્રેલિયામાં ગંભીર ગુનો છે.

ઓસ્ટ્રેલિયામાં લોકોને લગ્ન કરવાં કે નહીં અને કોની સાથે લગ્ન કરવાં તે નક્કી કરવાની સ્વતંત્રતા છે. સામાન્ય રીતે, કાયદેસર લગ્ન કરવાં માટે જે તે વ્યક્તિ 18 વર્ષથી વધુ ઉંમરની હોવી જોઈએ. અમુક સંજોગોમાં 16 વર્ષથી ઉપરની વ્યક્તિ 18 વર્ષથી ઉપરની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, પરંતુ તે માટે કોર્ટની મંજૂરીની જરૂર પડે છે.

કોઈને લગ્ન માટે બળજબરી કરવી, ધમકી આપવી અથવા છેતરીને લગ્ન કરાવવાં એ ઓસ્ટ્રેલિયાના કાયદાની વિરુદ્ધ છે. જો તમે પીડિત વ્યક્તિ ન હો તો બળજબરીપૂર્વકનાં લગ્નને પ્રોત્સાહન આપવું અથવા તેની વ્યવસ્થા કરવામાં મદદ કરવી, અને બળજબરીપૂર્વકનાં લગ્નના પક્ષકાર હોવું એ પણ કાયદાની વિરુદ્ધ છે. આ કાયદેસર, સાંસ્કૃતિક અને ધાર્મિક લગ્નોને લાગુ પડે છે.

એરેન્જ મેરેજ (સગાં સંબંધી દ્વારા ગોઠવાયેલાં લગ્ન), કે જેમાં બંને વ્યક્તિઓએ પોતાની મરજીથી લગ્નની સંમતિ આપી હોય તે બળજબરીથી થતાં લગ્નથી જુદાં છે. ઓસ્ટ્રેલિયામાં એરેન્જ મેરેજને કાનૂની માન્યતા છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોવ તો 000 પર પોલીસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલીસ પાસે જવું સલામત છે અને તેમનાં પર વિશ્વાસ કરી શકાય છે.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો 131 450 પર ફોન કરો.

કોઈને બળજબરીથી લગ્ન કરાવવાં બીજા દેશમાં લઈ જવું કે મોકલી દેવું કે કોઈના દ્વારા તેની વ્યવસ્થા કરાવવી એ ગેરકાનૂની છે.

બળજબરીપૂર્વક લગ્ન કરાવવા માટે ક્યારેક લોકોને તેમની ઇચ્છા વિરુદ્ધ અથવા છેતરીને બીજા દેશમાં લઈ જવામાં આવે છે. આ કાયદાની વિરુદ્ધ છે અને તેના પરિણામે જેલની સજા થઈ શકે છે.

શું તમે કે તમારું કોઈ ઓળખીતું જોખમમાં છો?

જો તમે કે તમારું કોઈ ઓળખીતું બળજબરીપૂર્વકનાં કે વહેલાં લગ્નમાં હોય અથવા તેના જોખમમાં હોય, તો તમે મદદ માટે 131 237 (131AFP) પર ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (Australian Federal Police) (AFP) નો સંપર્ક કરી શકો છો.

AFP તમને સલામત રાખી શકે છે, શરૂઆતી સલાહસૂચન આપી શકે છે અને તમને મદદ માટેની બીજી સેવાઓ, જેવી કે રહેવાની વ્યવસ્થા, જરૂરી પૈસાની વ્યવસ્થા, સલાહસૂચન અને કાયદાકીય અને ઇમિગ્રેશનને લગતી સલાહ માટે નિર્દેશ કરી શકે છે. વધુ માહિતી AFP ની વેબસાઇટ [www.afp.gov.au](http://www.afp.gov.au) પર છે.

ઓસ્ટ્રેલિયામાં બીજી સેવાઓ પણ છે જે મદદ કરી શકે છે.

માય બ્લુ સ્કાય (My Blue Sky) એ બળજબરીપૂર્વકનાં લગ્નના નિવારણ, માહિતી, રેફરલ્સ અને મફત કાયદાકીય સલાહ માટે સમર્પિત ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વેબસાઇટ અને હેલ્પલાઇન છે.

(02) 9514 8115 પર ફોન કરો, 0481 070 844 પર ટેક્સ્ટ કરો, [help@mybluesky.org.au](mailto:help@mybluesky.org.au) પર ઇમેઇલ કરો, અથવા [www.mybluesky.org.au](http://www.mybluesky.org.au) પર My Blue Sky ની વેબસાઇટ પર જાઓ.

**1800RESPECT** એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's national sexual assault, family and domestic violence counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર કે ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનારાઓ તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

**1800 737 732** પર ફોન કરો અથવા **1800RESPECT** ની વેબસાઇટ **www.1800RESPECT.org.au** પર જાઓ.

## શું તમારે દુભાષિયાની જરૂર છે?

**131 450** પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (ટીસ) માટે ફોન કરો. ટીસમાંથી દુભાષિયો તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરશે, જોકે ટીસ દ્વારા સલાહ (counselling) આપવામાં આવતી નથી. બધા કોલ્સ મફત અને ખાનગી હોય છે.

## બળજબરીપૂર્વકનાં લગ્નની બાબતમાં વધુ માહિતી માટે:

**www.homeaffairs.gov.au** પર ગૃહ ખાતા (**Department of Home Affairs**) ની વેબસાઇટની મુલાકાત લો અને “forced marriage (બળજબરીપૂર્વકનાં લગ્ન)” શોધો.